

--: અખબાર યાદી :-

## રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હોટલ, હોસ્પિટલ, સ્કુલ, રેસીડેન્સ વેલફેર એસોસી./મોહલા, માર્કેટ એસોસી. માટે સ્વચ્છતા રેન્કિંગનું આયોજન: મ્યુનિ. કમિશનરશ્રી બંધાનિધિ પાની

તારીખ: ૧૩-૦૬-૨૦૧૯

રાજકોટ શહેરના સ્કુલ સંચાલકો, હોટલ માલિકો, તમામ હોસ્પિટલો, તમામ પ્રમુખ રેસિડન્સ વેલફેર એસોસિએશન/મોહલા, પ્રમુખ માર્કેટ એસોસિએશનને આથી જાણ કરવામાં આવે છે કે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આગામી સ્વચ્છ સર્વેક્ષણ લીગ ૨૦૨૦ ને ધ્યાને લઈને સમાજમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ હોટલ, સ્વચ્છ હોસ્પિટલ, સ્વચ્છ સ્કુલ, સ્વચ્છ રેસિડન્સ વેલફેર એસોસિએશન/મોહલા તથા સ્વચ્છ માર્કેટ એસોસિએશન માટે સ્વચ્છતા રેન્કિંગનું આયોજન કરવામાં આવેલ છે. આ સ્વચ્છતા રેન્કિંગમાં ભાગ લેનારને સ્વચ્છતાના જુદા જુદા પેરામીટર જેમકે ઈન્ફાસ્ટ્રક્ચર, સર્વિસ મેન્ટેનન્સ અને લોકોના ફીડબેક ઉપર દરેક કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબર આપવામાં આવશે, આ સ્વચ્છતા રેન્કિંગના વિજેતાઓને ગુજરાત રાજ્યના માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે સર્ટિફિકેટ આપવામાં આવશે, તેમ મ્યુનિ. કમિશનરશ્રી બંધાનિધિ પાનીએ જણાવ્યું હતું.

વધુ માહિતી આપતા કમિશનરશ્રીએ કહેલું કે, આ સ્વચ્છતા રેન્કિંગ ભાગ લેવા માટેના ફોર્મ નીચેના સ્થળ પરથી મેળવી લેવાના રહેશે.

### રૂબરૂ ફોર્મ લેવા તથા જમા કરાવવા

૧) પ્રોગ્રામ ઈમપ્લીમેન્ટેશન યુનિટ (આઈ.ઈ.સી- સેલ) પ્રથમ માળ રૂમ નં - ૭, ઢેબર રોડ, સેન્ટ્રલ ઝોન, રાજકોટ મહાનગરપાલિકા ફોન નં - ૨૨૨૮૧૭૭

૨) ઓલ ઇન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ- રાજકોટ (સમય ૧૧ થી બપોરે ૩ સુધી) કોઠારિયા નાકા ચોક , કિશોર સિહજી સ્કુલ પાસે, રાજકોટ ફોન :- ૨૨૨૯૬૦૪

નિયમો:-

૧. આ સ્વચ્છતા રેન્કિંગ ત્રી-માસીક (ક્વાર્ટરલી) કરવામાં આવશે

૨. આયોજકે [www.swachhmanch.in](http://www.swachhmanch.in) પર પોતાનાની સંસ્થાના નામે ઇવેન્ટ બનાવવાની રહેશે તથા વધારેમાં વધારે લોકોને Volunteer કરવાના રહેશે.

૩. સ્વચ્છતા જાગૃતિ અંગેના બેનર તથા હોર્ડિંગ લાગવાના રહેશે તેમાં સ્વચ્છ સર્વેક્ષણ લીગ ૨૦૨૦ નો લોગો તથા મહાત્મા ગાંધી ૧૫૦મી જન્મ જયંતિનો લોગો લગાવો ફરજિયાત છે. (લોગો તથા બેનરની ડિઝાઇન પ્રોગ્રામ ઈમ્પ્લીમેન્ટેશન યુનિટ (આઈ.ઈ.સી- સેલ) પ્રથમ માળ રૂમ નં - ૭, ઢેબર રોડ, સેન્ટ્રલ ઝોન, રાજકોટ મહાનગરપાલિકા ફોન નં - ૨૨૨૮૧૭૭ મળી રહેશે.)

૪. આ સ્વચ્છતા રેન્કિંગ આખરી નિર્ણય મ્યુનિસિપલ કમિશનર અને નાયબ મ્યુનિસિપલ કમિશનર હસ્તગત SWM કમિટીનો રહેશે જે દરેક ભાગ લેનાર સંસ્થાએ બંધન કરતા રહેશે.

૫. ફોર્મ પરત કરવાની છેલ્લી તારીખ ૧૮/૦૬/૨૦૧૯ રહેશે

(જન સંપર્ક અધિકારી)

રાજકોટ મહાનગરપાલિકા